

ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 - કરન્ટ એકાઉન્ટ વ્યવહાર વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ એપી (ડીઆઈઆરસિટીઝ) પરિપત્ર નં. 73 (જાન્યુઆરી, 24, 2003)

**રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
એક્સચેન્જ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ
સેન્ટ્રલ ઓફિસ, મુંબઈ 400 001**

એપી (ડીઆઈઆર સિટીઝ) પરિપત્ર નં. 73

24 જાન્યુઆરી, 2003

પ્રતિ
વિદેશી મૂડીના તમામ અધિકૃત ડિલરો
મેડમ/સાહેબ
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999

કરન્ટ એકાઉન્ટ વ્યવહાર - વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

ભારત સરકારના 3 મે 2000ના જાહેરનામા ક્રમાંક જીએસઆર 381 (ઈ) પ્રત્યે અધિકૃત ડિલરોનું ધ્યાન ખેંચવામાં આવે છે જેમાં 30 માર્ચ 2001ના જાહેરનામા ક્રમાંક એસ.ઓ. 301(ઈ) મુજબ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (કરન્ટ એકાઉન્ટ વ્યવહાર) માં સુધારા કરાયા છે જે મુજબ કરન્ટ એકાઉન્ટ વ્યવહારમાં ચોક્કસ ઉપાડને પ્રતિબંધિત કરાયેલ છે અને અન્ય વ્યવહારો પર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

2. ભારત સરકારે 15 જાન્યુઆરી 2003 (નકલ જોડેલી છે) ના જાહેરનામા ક્રમાંક જીએસઆર 33 (ઈ)થી 3મે 2000 ના જાહેરનામા ક્રમાંક જીએસઆર 359 (ઈ)માં સુધારા કરેલા છે. અધિકૃત વિકેતાઓને આથી સલાહ આપવામાં આવે છે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (કરન્ટ એકાઉન્ટ વ્યવહાર) રૂલ્સ, 2000 હેઠળ નિયમ 5 માં જણાવ્યા પ્રમાણેના નિયમો જોવા માટે રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે, તે હવે ભારત બહાર પ્રવાસ દરમિયાન કાર્ડની મર્યાદાથી ઉપર રહેવાસી દ્વારા ખર્ચ માટે ચૂકવણી કરતી વખતે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ (આઈસીસી)ના ઉપયોગ માટે લાગુ નહીં પડે. આ ઉપરાંત રિઝર્વ બેંક ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 હેઠળ આઈસીસીના ઉપયોગ માટે અલગથી કોઈ નાણાકીય કે આઈટમવાઈઝ ટોચ મર્યાદા લાગુ પાડી નથી. આઈસીસી હેઠળ ખરીદીની જે આઈટમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે તેમાં લોટરીની ટિકીટો, પ્રતિબંધિત મેગેઝિનો, જુગામાં હિસ્સેદારી, કોલ બેંક સર્વિસમાં ચૂકવણી વગેરેનો સમાવેશ થાય છે જે ચાલુ રહેશે.

3. અધિકૃત ડિલરો આ પરિપત્રની વિગતો પોતાના સંબંધિત ગ્રાહકોના ધ્યાનમાં લાવી શકશે.

4. આ પરિપત્રમાં જણાવવામાં આવેલ દિશાનિર્દેશ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 (1999ના 42)ના સેક્શન 10(4) અને સેક્શન 11(1) હેઠળ ઇસ્તૂ કરવામાં આવેલા છે.

આપનો વિશ્વાસુ

ગ્રેસ કોશી
ચીફ જનરલ મેનેજર

ધ ગેઝેટ ઓફ ઇન્ડિયા એકસ્ટ્રા ઓર્ડિનરી
ભાગ-II, સેક્શન-3, સબ-સેક્શન (I)

ઓથોરિટી દ્વારા પ્રસિદ્ધ

નવી દિલ્હી, ગુરુવાર, જાન્યુઆરી 16, 2003/પાંચ 26, 1924 નં. 23 નાણા અને કંપની બાબતોનો મંત્રાલય
(આર્થિક બાબતોનો વિભાગ)

જાહેરનામું

નવી દિલ્હી, 15 જાન્યુઆરી, 2003

જીએસઆર 33(ઈ) ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (1999ના 42) ના સેક્શન 46 ના પેટા-સેક્શન (2) ના ક્લોઝ (એ) અને સેક્શન 5 અને પેટા સેક્શન (1) હેઠળ આપેલી સત્તા મુજબ અને રિઝર્વ બેંક સાથે વિરાટ વિમર્સ બાદ કેન્દ્ર સરકારે જાહેરહિત માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (કરન્ટ એકાઉન્ટ વ્યવહાર રૂલ્સ, 2000 માં નીચે મુજબના ફેરફારો કરવાનું આવશ્યક જાણ્યું છે. આ સુધારા છે :

1. ટૂકું ટાઈટલ અને શરૂઆત : (1) આ નિયમો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (કરન્ટ એકાઉન્ટ વ્યવહાર) (સુધારા) રૂલ્સ, 2003 તરીકે ઓળખાશે. (2) સત્તાવાર ગેઝેટમાં તે પ્રસિદ્ધ થયાની તારીખથી તે એમલમાં આવશે.

2. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (કરન્ટ એકાઉન્ટ વ્યવહાર) રૂલ્સ, 2000 માં નિયમ 6 બાદ નીચેના નિયમો ઉમેરવાના રહેશે. જેમ કે ભારત બહાર આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ - નિયમ 5 માં જણાવેલ કોઈ પણ બાબત કોઈ વ્યક્તિ ભારત બહાર હોય ત્યારે વ્યક્તિ દ્વારા ખર્ચ પેટે ચૂકવણી માટે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટે લાગુ નહીં પડે.

ફૂટ નોટ : મુખ્ય નિયમો 3જી મે, 2000 ના સત્તાવાર ગેઝેટ જીએસઆર 381(ઈ)માં ભાગ-II, સેક્શન 3 અને પેટા સેક્શન (i) માં પ્રસિદ્ધ થયા હતા અને 30 માર્ચ, 2001 ના એસઓ 301(ઈ) થી તેમાં સુધારો કરવામાં આવ્યો હતો.

(એફ ક્રમાંક 1/5/ઈસી/2000 ભાગ-2)

સંજીવ મિશ્રા, સંયુક્ત સચિવ